

ત્વરિત જાહેરાત માટે

સિટી ઇમેન્સિપેશન ડેની ઉજવણી ફૂડ ટ્રક ફેસ્ટિવલથી કરશે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (23 જુલાઈ 2021) – ઓગસ્ટ 1ના રોજ સીટી ઓફ બ્રેમ્પટન આપ સહુને ઇમેન્સિપેશન ડેની ઉજવણી કરવાનું આમંત્રણ પાઠવે છે, જે વિશ્વભરમાં આફ્રિકન વંશના લોકોની ગુલામી નાબૂદ થયાના સ્મરણાર્થે ઉજવાય છે. પ્રસંગનો પ્રારંભ કેન વિલવાન્સ સ્ક્વેર ખાતે સવારે 10 વાગ્યે ઈન-પરસન ધ્વજરોડણથી થશે, જેના બાદ ફૂડ ટ્રક ફેસ્ટિવલ થશે જેમાં સામેલ છે સંગીત અને મનોરંજન જે મધ્યાહનથી લઈને છેક સાંજે 8 વાગ્યા સુધી ઇમેન્સિપેશન પાર્ક, 7599 ડિક્સિ રોડ ખાતે ચાલતો રહેશે. સહભાગી થવા માટે આગોતરું રજિસ્ટ્રેશન જરૂરી છે.

સીટી ઓફ બ્રેમ્પટનના [આર્થિક સશક્તિકરણ અને અશ્વેત રંગભેદ વિરોધી જાતિવાદ યુનિટ](#) દ્વારા *પાર્સિંગ દ ટોર્ચ એવોર્ડ્સ* નું લોકાર્પણ થશે જે એક એવો સન્માન આપવાનો કાર્યક્રમ છે જે અશ્વેત યુવાનો અને પ્રવર્તકોને ભેગા કરવાનું કાર્ય કરશે જે જ્ઞાન ઉપાર્જન અને સફળતાના માર્ગનો પ્રતીક બની રહેશે. કીનોટ વક્તા ઝનાના અકદે, જેઓ ઓન્ટારિયો લેજિસ્લેટિવ અસેમ્બલના ચૂંટાયેલ પ્રથમ અશ્વેત મહિલા છે તેઓ કેન વિલવાન્સ સ્ક્વેર ખાતે ધ્વજરોડણ પછી આ પારિતોષિકના કાર્યક્રમનું લોકાર્પણ કરશે.

ધ્વજરોડણમાં હાજરી આપવા અથવા ફૂડ ટ્રક ફેસ્ટિવલમાં પોતાનું ટેબલ બૂક કરવા માટે અહીં મુલાકાત

લો brampton.ca/events

2020માં ડિક્સિ 407 સ્પોર્ટ્સ પાર્કનું નામ બદલીને ઇમેન્સિપેશન પાર્ક કરીને સિટીએ પ્રથમ વખત ઇમેન્સિપેશન ડેનો સ્વીકાર કર્યો હતો જેમાં નાઅ અને મોટા સોફ્ટના મેદાનો છે તેમજ ક્રિકેટના મેદાનો છે. આ વર્ષે અમે બધાને કેરિબિઅન વારસા અને સ્વાતંત્ર્યને અને બ્રેમ્પટનના અશ્વેત સમાજના યોગદાનને સન્માનિત કરવાનું આમંત્રણ પાઠવીએ છીએ, અને કલા, સંસ્કૃતિ, વ્યંજનો અને સમાજ સંગ આપણા વૈવિધ્યને ઉજવીશું.

સુવાક્યો

"બ્રેમ્પટનની વૈવિધ્યસભર પૃષ્ઠભૂ જ આ શહેરને મોહક વૈવિધ્ય સાથે અનન્ય બનાવે છે, જેને આપણે વધાવીએ છીએ અને જીવંત રાખીએ છીએ. ગત વર્ષમાં સિટી કાઉન્સિલે બ્રેમ્પટનમાં ઓગસ્ટ 1ના દિનને ઇમેન્સિપેશન ડે તરીકે જાહેર કર્યો હતો અને ડિક્સિ 407 સ્પોર્ટ્સ પાર્કનું નામ બદલીને ઇમેન્સિપેશન પાર્ક રાખ્યું હતું જેથી વૈશ્વિક માન્યતા સાથે જોડાઈ શકાય અને ભૂતકાળનું સ્મરણ કરી શકાય કારણકે આપણે સહુ તમામ બ્રેમ્પટનવાસીઓ માટે ન્યાયપૂર્ણ અને સમાન ભવિષ્ય માટે કાર્ય કરી રહ્યા છીએ."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"ગત વર્ષમાં સિટીના અશ્વેત વિરોધી જાતિવાદ યુનિટે સખત પરિશ્રમ ઉઠાવીને બ્રેમ્પટનના અશ્વેત સમાજ સાથે જોડાવા માટે કાર્ય કર્યું છે જેથી તેઓ સાથે આપણા હાલના વાતાવરણ અને વિકાસ તેમજ સહાય અંગેની અર્થપૂર્ણ ચર્ચાઓ થઈ શકે. ઈમેન્સિપેશન કે સમસ્ત સમાજ સાથે જોડાવા માટેની એક રીતે છે જેથી બ્રેમ્પટનના અશ્વેત વારસાને તેમજ સંસ્કૃતિને વધાવી શકાય અને તે વાર્તાલાપોને અવિરત ચાલુ રાખી શકાય."

- શેરમેન વિલિયમ્સ (Charmaine Williams) સીટી કાઉન્સિલર, વોર્ડ 7 અને 8, સીટી ઓફ બ્રેમ્પટન

"કાર્યસ્થળ પર તેમજ આપણા સમાજમાં સિટી ઓફ બ્રેમ્પટન વૈવિધ્ય, સમાનતા અને સમાવેશિતાને વરેલું છે. આપણી અશ્વેત વિરોધી જાતિવાદ યુનિટ સમાજમાં પ્રસ્થાપિત થઈ ચૂકી છે અને બ્રેમ્પટનમાં પરિવર્તન તરફી કાર્ય માટેના સક્રિય સહયોગી બન્યા છે. આ પ્રકારના પ્રસંગોથી આપણે નવા સંભાષણો શરૂ કરી શકીએ છીએ અને બ્રેમ્પટનની અશ્વેત સંસ્કૃતિ અને સમાજને સન્માનિત કરી શકીશું."

- ડેવિડ બાર્રિક (David Barrick), CAO, સિટી ઓફ બ્રેમ્પટન

"આજની નવી પેઢી આખા વિશ્વમાં જુલમી સામાજિક રૂઢિઓમાંથી મુક્ત કરવાના કાર્ય સાથે પ્રવૃત્ત રહે અને તે ચાલુ રાખે તે અગત્યનું છે. ઓગસ્ટ 1લીના દિને તેવા અનેકનું સન્માન કરવું તે અમારે માટે અગ્રિમ છે જેઓએ આપણે માટે એક માર્ગ આલેખ્યો છે અને તેમનાથી પ્રેરણા લઈને તેઓના વારસાથી ભાવિ નેતૃત્વને પ્રેરિત કરીશું. પેઢીઓ વચ્ચેના અંતરને જોડી લેવા માટે યુનિટ લોકાર્પણ કરે છે પાસિંગ દ ટોર્ચ એવોર્ડ્સ જે સફળ અશ્વેત યુવાનોની કદર કરશે જેઓ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે."

- ગ્વિનેથ ચેપમેન, વરિષ્ઠ સલાહકાર, આર્થિક સશક્તિકરણ અને અશ્વેત વિરોધી રંગબેદ (Economic Empowerment and Anti-Black Racism), સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

Prabhjot Kainth

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Prabhjot.Kainth@brampton.ca

